

૪(૧)(ખ)(૨)

હેરીટેજ સેલનાં અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

કેડરવાઈઝ કામગીરીનું પત્રક

અ. નં	કેડર	અધિકારી/ કર્મચારી ની સંખ્યા	કામગીરી
૧	કાર્યપાલક ઈજનેર હેરીટેજ સેલ	- ૦૧(સીવીલ):- પદ્ધીક ઈન્જિનિયર સેલ, સ્વીમીંગ પુલ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ, ડે.જનરલ મેનેજર, સીટીઝ-॥ (બાયો ડાયર્વસીટી પાર્ક) હેરીટેજ સેલની કામગીરી ઉપરાંત સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી.	<ul style="list-style-type: none"> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલ હસ્તકની તમામ કામગીરી સમયસર કરાવવાની તેમજ ખાતાના વડા તરીકે ખાતાની તમામ વહીવટી કામગીરી કરાવવાની જવાબદારી.</li> <li>તાબા હેઠળના તમામ કર્મચારીઓને કામગીરીનું વિતરણ, સુપરવિઝન વિગેરેને લગતી કામગીરી.</li> <li>આર.ટી.આઈ અંતર્ગત અપીલ અધિકારી તરીકેની કામગીરી.</li> </ul>
૨	ડ. ઈજનેર (સીવીલ)	૦૧(સીવીલ):-(હેરીટેજ સેલની કામગીરી ઉપરાંત સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી)	<ul style="list-style-type: none"> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી સંબંધિત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન સાથે સંકલન, જરૂરી પત્રવ્યવહાર તેમજ કામગીરી સંબંધિત જરૂરી વિગત મેળવવા સંબંધિત કામગીરી તેમજ ડે.ઈજનેરશ્રી નીચેની કક્ષાના કર્મચારી પાસે ખાતાને લગતી તમામ પ્રકારની કામગીરી કરાવવાનું કામ.</li> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલ ના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય) અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ(કરારીય) ધ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનના સામાન્ય પ્રકલ્પોના પ્રોજેક્ટ અન્વયે બનાવવામાં આવેલ પ્લાનીગ, અંદાજ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વિવિધ ઝોન સાથે પત્રવ્યવહાર કરી ફોરવર્ડ કરવા સંબંધિત કામગીરી.</li> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલ ની કામગીરી અન્વયે જરૂરી માહિતી, બજેટની માહિતી તૈયાર કરવા સંબંધિત કામગીરી .</li> <li>આર.ટી.આઈ અંતર્ગત જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.</li> </ul>
૩	ડ. ઈજનેર (ઈલે.)	૦૧(ઈલે.):- (હેરીટેજ સેલની કામગીરી ઉપરાંત સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી)	<ul style="list-style-type: none"> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી સંબંધિત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન સાથે સંકલન, જરૂરી પત્રવ્યવહાર તેમજ કામગીરી સંબંધિત જરૂરી વિગત મેળવવા સંબંધિત કામગીરી તેમજ ડે.ઈજનેરશ્રી નીચેની કક્ષાના કર્મચારી પાસે ખાતાને લગતી તમામ પ્રકારની કામગીરી કરાવવાનું કામ.</li> <li>સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલ ના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય) અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ(કરારીય) ધ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનના સામાન્ય પ્રકલ્પોના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ પ્લાનીગ અન્વયે ઝોન ધ્વારા તૈયાર કરવામાં આવતા ઈલે. કામના અંદાજ સંદર્ભે સંબંધિત ઝોન સાથે જરૂરી સંકલન તેમજ ફાયર વિભાગ ધ્વારા તૈયાર કરવામાં</li> </ul>

			<p>આવતા ફાયર ફાયટીંગ સીસ્ટમના અંદાજો સંદર્ભે ફાયર વિભાગ સાથે જરૂરી સંકલનની કામગીરી.</p> <ul style="list-style-type: none"> <li>• સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલ ની કામગીરી અન્વયે જરૂરી માહિતી, બજેટની માહિતી તૈયાર કરવા સંબંધિત કામગીરી .</li> <li>• આર.ટી.આઈ અંતર્ગત જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.</li> </ul>
૪	આસી. ઇજનેર(સીવીલ),	- ૦૧(સીવીલ) કામગીરી ઉપરાંત સેલની કામગીરી)	<p>(હેરીટેજ સેલની સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટીના કામોના પરીક્ષણ કરવા અંગે સ્ટ્રક્ચરલ પરીક્ષણ કરતી એજન્સી પાસે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા જણાવ્યા મુજબ સ્ટ્રક્ચરલ પરીક્ષણ કરવાની કામગીરી અંગે લેખિત સંમતિ/ઓફર મંગાવવા તેના એશ્રીમેન્ટ અને બીલ ચુકવવા સંબંધિત કામગીરી.</p> <ul style="list-style-type: none"> <li>• સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલમાં વિવિધ ઝોનના સામાન્ય પ્રકલ્પોના પ્રોજેક્ટના કામો અંગે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા કરવામાં આવતી સ્ટ્રક્ચરલ ડિઝાઇનના પૂર્ફ ચેકીંગની કામગીરી અંગે ઓફર/કવોટેશન મંગાવવાની જે કામગીરી એપ્રુવ થયેથી તેના એશ્રીમેન્ટ અને બીલ ચુકવવા સંબંધિત કામગીરી.</li> <li>• સેન્ટ્રલ ડિઝાઇનીગ સેલની કામગીરી સંબંધિત જરૂરી માહિતી, બજેટ તૈયાર કરવા સંબંધિત કામગીરી.</li> </ul>
૫	સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય)	-૦૨(સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય))	<ul style="list-style-type: none"> <li>• સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આયોજન હેઠળના સામાન્ય બિલ્ડીંગોના ઉપરોક્ત સેન્ટ્રલ ડિઝાઇનીગની કામગીરીમાં સુચિત બિલ્ડીંગોના Latest I.S.CODE મુજબ સ્ટ્રક્ચરલ ડિઝાઇન બનાવવી તેના સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ તૈયાર કરાવવા તેમજ સ્ટ્રક્ચરલ ડિઝાઇનની પૂર્ફ ચેકીંગ કરાવી તેના એપ્રુવ ડ્રોઈંગ સંબંધિત ઝોને મોકલવા સંબંધિત કામગીરી. સ્થળ પર કરવામાં આવતી કામગીરી અંગે સ્ટ્રક્ચરલ ડિઝાઇન મુજબ સાઈટ પર ઇન્સ્પેક્શન/ચકાસણીની કામગીરી.</li> <li>• સુરત મહાનગરપાલિકાના સામાન્ય પ્રકલ્પોના હયાત બિલ્ડીંગોના સ્ટ્રક્ચરલ સેફ્ટી/સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી રીપોર્ટ, સ્ટ્રક્ચરલ અભિપ્રાય આપવાની કામગીરી તેમજ તેના રીહેબીલીટેશન/સ્ટ્રેન્ધનીં/રીપેરીંગની કામગીરીની મેથોડોલોજી પુરી પાડી અંદાજો તૈયાર કરાવી તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરી પુરા પાડવા સંબંધિત કામગીરી.</li> <li>• સુરત મહાનગરપાલિકાના ઝોન/વિભાગ ધ્વારા સામાન્ય બિલ્ડીંગોના પ્રોજેક્ટની કામગીરી અંગે</li> </ul>

			<p>આઉટસોર્સથી નિયુક્ત કરવામાં આવેલ કન્સલ્ટન્ટ ધ્વારા કરવામાં આવેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇનના પ્રુફ ચેકીંગ સંબંધિત કામગીરી.</p> <ul style="list-style-type: none"> <li>• સદરહું બિલ્ડીગોના તૈયાર કરવામાં આવેલ અંદાજની ચકાસણી કરી સહી સિક્કા સહિત એપ્રુવ કરી સંબંધિત જોનને મોકલવા સંબંધિત કામગીરી.</li> </ul>
૬	આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય)	-૦૧ આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય)	<ul style="list-style-type: none"> <li>• સુરત મહાનગરપાલિકાના વિવિધ જોનમાં આયોજન હેઠળના સામાન્ય બિલ્ડીગોના ઉપરોક્ત સેન્ટ્રલ ડિઝાઇનીગની કામગીરીમાં સુચિત્ર પ્રોજેક્ટના આર્કિટેક્ચર પ્લાનીગ Latest GDCR ના નિયમ મુજબ બનાવવા, વર્કીંગ ડ્રોઈંગ, એલીવેશન તૈયાર કરવા.</li> <li>• સામાન્ય બિલ્ડીગોના ઉપરોક્ત સેન્ટ્રલ ડિઝાઇનીગની કામગીરીમાં સુચિત્ર બિલ્ડીગોના જરૂરી બિલ્ડીગોના પ્લાનીગ Latest GDCR ના નિયમ મુજબ બનાવવા તેના પ્લાન પાસીગના ડ્રોઈંગ તૈયાર કરાવી સંબંધિત જોનને સહી સિક્કા સહિત એપ્રુવ કરી મોકલવા સંબંધિત કામગીરી.</li> <li>• સદરહું બિલ્ડીગોના તૈયાર કરવામાં આવેલ અંદાજની ચકાસણી કરી સહી સિક્કા સહિત એપ્રુવ કરી સંબંધિત જોનને મોકલવા સંબંધિત કામગીરી.</li> </ul>
૭	ડ્રાફ્ટ મેન	-૦૨ (સીવીલ): (સેન્ટ્રલ જોન અને રાંદેર જોનમાંથી ઓનલોન)	<ul style="list-style-type: none"> <li>• આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સામાન્ય પ્રકલ્પોના બિલ્ડીંગ પ્લાનીગ, લે-આઉટ, વર્કીંગ ડ્રોઈંગ, સેક્શન ડ્રોઈંગ અને એલીવેશન ડ્રોઈંગ તૈયાર કરવા.</li> <li>• સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ડ્રોઈંગ, સેક્શન ડ્રોઈંગ તૈયાર કરવા તથા તેની જાળવણી કરવી.</li> </ul>
૮	સુપરવાઈઝર	-૦૧ (સીવીલ): (બ્રીજ સેલમાંથી ઓનલોન)	<ul style="list-style-type: none"> <li>• આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ(કરારીય) અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ(કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સામાન્ય પ્રકલ્પોના બિલ્ડીંગના અંદાજ બનાવવાની કામગીરી તથા તેની જાળવણી કરવી.</li> </ul>
૯	ટેક.આસી.	-૦૧ (સીવીલ): (વરાણ જોન-બી (સરથાણા) માંથી ઓનલોન)	<ul style="list-style-type: none"> <li>• આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ(કરારીય) અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ(કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સામાન્ય પ્રકલ્પોના બિલ્ડીંગના અંદાજ બનાવવાની કામગીરી તથા તેની જાળવણી કરવી.</li> </ul>
૧૦	ટેક.આસી.	-૦૧ (સીવીલ) (સેન્ટ્રલ જોનમાંથી ઓનલોન)	<ul style="list-style-type: none"> <li>• આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સામાન્ય પ્રકલ્પોના બિલ્ડીંગ પ્લાનીગ, લે-આઉટ, વર્કીંગ ડ્રોઈંગ, સેક્શન ડ્રોઈંગ અને એલીવેશન ડ્રોઈંગ તૈયાર કરવા.</li> <li>• સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ (કરારીય) ધ્વારા સૌંપવામાં આવેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ડ્રોઈંગ, સેક્શન ડ્રોઈંગ તૈયાર કરવા તથા તેની જાળવણી કરવી.</li> </ul>

૧૦	ડે. એકાઉન્ટ	-૦૧ (એકાઉન્ટ વિભાગની કામગીરી, સીનીયર એકાઉન્ટન્ટ તરીકે ટ્રેઝરી વિભાગની કામગીરી, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ પ્રેન્ટીંગ પ્રેસ, રેકર્ડ બ્યાંચ, કલ્યરલ ડિપાર્ટમેન્ટ, પબ્લિક રેલીશન ડિપાર્ટમેન્ટ ઉપરાંત વધારાની સેન્ટ્રલ ડિઝાઇનીંગ સેલની કામગીરી).	<ul style="list-style-type: none"> <li>ખાતાના રેવન્યુ, કેપીટલ તથા પર્સનલ એડવાન્સ બીલો ચેક કરવાની કામગીરી. કેપીટલ તથા રેવન્યુ બજેટ તૈયાર કરવાની કામગીરી.</li> </ul>
૧૧	આસી.એકાઉન્ટન્ટ	-૦૧ ((એકાઉન્ટ વિભાગ:- (એન.પી.એસ.ડિપાર્ટમેન્ટ, ઓ.પી.એસ. ડિપાર્ટમેન્ટ, બજેટ સેક્શન, ગ્રાંટ સેક્શન), શ્રીજ સેલ, એસ.એમ.સી. રિલીફ ટ્રસ્ટ ઉપરાંત વધારાની સેન્ટ્રલ ડિઝાઇનીંગ સેલની કામગીરી).	<ul style="list-style-type: none"> <li>ખાતાના રેવન્યુ, કેપીટલ તથા પર્સનલ એડવાન્સ બીલો ચેક કરવાની કામગીરી. કેપીટલ તથા રેવન્યુ બજેટ તૈયાર કરવાની કામગીરી.</li> <li>સેન્ટ્રલ ડિઝાઇનીંગ સેલની કામગીરી અંગે હિસાબી ખાતા સાથે સંકલન, ઓડિટ ઓફ્જેક્શન, જર્નરલ એડવાન્સ અંગેની આંકડાકીય માહિતીઓનું પૂછ્યકરણ.</li> </ul>
૧૨	પટાવાળા	-૦૧-(કાયમી) : પબ્લિક ઇન્ફ્રા. સેલમાંથી ઓનલોન	<ul style="list-style-type: none"> <li>ખાતાની ટપાલ વહેંચવાની તેમજ સાફ્સફાઈ તથા સ્ટાફના હુકમ અનુસાર કરવાપાત્ર કામગીરી વગેરે.</li> </ul>